

૨૦૩
વર्ष

દેનિક

સૌરાષ્ટ્ર આવૃત્તિ

મુંબઈ સમાચાર

સુનાયથી પ્રશિક્ખ થતું ■ સ્થાપના: ૧ જુલાઈ ૧૮૨૨ ■ પુસ્તક: ૨૦૪ ■ Volume 68 ■ Issue 63 ■ વિકાસ સંવત ૨૦૮૧
■ ફાયુન વડ - ૩ ■ મુંબઈ ■ MUMBAI SAMACHAR ■ www.bombaysamachar.com ■ 17 March 2025, Monday ■ REGD.No. MCS/058/2018-20

R.N.I. No. GUJ GUJ/201358486

સોમવાર, ૧૭ માર્ચ ૨૦૨૫ (૧૦ પાના), કિંમત ₹ ૧૦.૦૦

ઇર્ભતેજ પૂર્તિ

પ્રકાશન પદ્ધતિ

LIKE & FOLLOW: [f](#) /Mumbaisamachar4u

બલુચિસ્તાનમાં બીઅનેલાનો આત્મધાતી હુમલો

૬૦ સૈનિકનાં મોત

હસ્તામાબાદ: પાકિસ્તાનનાં બલુચિસ્તાનમાં પાકિસ્તાની સેનાના કાફકા પર આત્મધાતી હુમલાની કરવામાં આવ્યો છે.

બલુચિસ્તાનનાં નોશકીમાં સેનાના કાફકા પર આત્મધાતી હુમલાની કરવામાં આવ્યો છે.

આ હુમલાની જાવાબદારી બલુચિસ્તાન સેનાનાં ૮૦

સૈનિક માથા ગયા દ્વારા કરવામાં આવ્યો છે.

પ્રાણ વિગતો અનુસાર પાકિસ્તાનનાં બલુચિસ્તાનમાં

ટ્રેન લાંબું કરી હતું કરવાના બાદ બલુચિસ્તાન આર્મી દ્વારા

પાકિસ્તાની સેનાના કાફકા પર આત્મધાતી હુમલાની કરવામાં આવ્યો છે.

અહેવાળો અનુસાર, બલુચિસ્તાનનાં નોશકી

જિલ્લામાં આત્મધાતી હુમલાની જાવાબદારી બલુચિસ્તાનનાં સેનાનાં ૮૦

સૈનિક માથા ગયા દ્વારા કરવામાં આવ્યો છે.

બલુચિસ્તાન વિભાગના આમાન્ય પ્રકતા જિયાન બલોચે

જાણાયું હતું કે એક આત્મધાતી હુમલાની એક બસને નિશાન

સેનાનાં કાફકા સાથે અથડાયું હતું.

બલુચિસ્તાન વિભાગના આમાન્ય પ્રકતા જિયાન બલોચે

જાણાયું હતું કે એક આત્મધાતી હુમલાની એક બસને નિશાન

સેનાનાં કાફકા સાથે અથડાયું હતું.

દેશમાં દ્રાસ વિરોધી ઝુંબેશ તીપ્રિ: ત્રણ

રાજ્યમાંથી ૧૮૭ કરોડનું દ્રાસ પકડાયું

દ્રાસ-ગુવાહાટીમાંથી ૮૮ કરોડ, મેંગલુરુમાંથી ૭૫ કરોડ

અને આસામમાંથી ૨૪ કરોડ રૂપિયાનું કેફી દ્રાસ પકડાયું

નવી દિલ્હી: દેશમાં દ્રાસ વિરોધી અભિયાનમાં ૧૮૭

કરોડ રૂપિયાનું દ્રાસ જાત કરવામાં આવ્યું હતું એક રીપોર્ટ

અનુસાર, કાંપાટકા મેંગલુરુમાંથી ૨ કરોડ રૂપિયાનું

આસામમાંથી ૨ કરોડ રૂપિયાનું દ્રાસ જાત કરવામાં

આવ્યું હતું. અને દ્રાસ-ગુવાહાટીમાંથી ૮૮ કરોડ રૂપિયાની

દિલ્હીની 'મેંગલુરુમાઠન' ની ગોલીઓ જમ કરી હતું.

કેફીની ગુણ મધ્યમાં આત્મધાતી હુમલાની કરવામાં

આવ્યો છે અને દ્રાસની ગુણાં ચાર સભ્યની વિભાગમાં

ચાર સભ્યની વિભાગમાં આત્મધાતી હુમલાની કરવામાં

આવ્યો છે. ગુણ મધ્યમાં આત્મધાતી હુમલાની કરવામાં

આવ્યો છે

અમે જગજીતને લઈને મંદોરથી મુંબિથી પરત જવાનું વિચારતા હતા ત્યારે શિવાનંદજી કહે:

‘આપણે જગજીતના મનનાંથી પેલા અંગોરોથી ભય કાઢવાની જરૂર છે. આપણે અમે તેમ કરી પેલા અંગોરોથી અર્થી લાવવો જોઈએ. એ અંગોરી જ જગજીતના મનનાંથી એનો ભય દૂર કરી શકતો. આપણે અર્થીથી ચાચવા ગયા તાં આ શકતો જ નની રહ્યું.’

મને અને પ્રમોદને ગળે આ વાત ઉત્તરી ગઈ કે આપણે અંગોરોથી પદકી - એના પગ પકીને પણ જગજીતના પાસે માર્ગ મગાવી એની પસેથી જ અને જીવતદાન આપવાનું પડશે. આવું નક્કી કર્યા પછી હું એ શિવાનંદ પેલા અંગોરોને શોખાં મૈસ્કુની ડ્રેપાની.

મૈસ્કુની પદકોંચાં ત્યારે રાતના દસ વાગવાની તૈયારી હતી. સ્વામી શિવાનંદ જી પોતાના એક અંગોરોથાના ઘર પાસે લેવાની. આ સ્વામીની એક મહિસુંહ એ છે એને ભારતના ગમે તે શરેરે કે ગમાનો અનેક મિત્રો છે. અમે એક મોટા દરવાજાના દેલા પાસે આવી થોયા. દરવાજા પર એક લાઈક સાંક્રાન્યો નહીં કાર્યક્રમોની સંસ્કૃતિના પ્રતીક જોયે રિમેન્ટ કોંટ્રિટ્માંથી બાળાની પણ રંગ ચાચવી રંગીન બનાવવામાં આવ્યો હતો. મ્યુનિસિપાલિટીની રેડ લાઇટમાં દ્રાણ આકાશની પૂર્ણભૂષણ પર એ જીવન લાગતો હતો.

શિવાનંદ જ દરવાજો ખખાય્યો. થોડી વાર પછી એક કંડા હુંણી પેરેલો વાદુ આવી દરવાજો ખોલ્યો. સ્વામી સામે એ થોડી વાર આખાય્યો જોતો રહ્યો. પછી દરવાજાનાંથી હઠીને આવકાર આપતો કરતું હતો. એવી વારથી હોયે:

‘સ્વામી, અત્યારે ને? તેમે જોઈ આથર્થ થયું પણ હું તમે આવી પણ હું?’

શિવાનંદ જ મારો પરિચય એક તસ્વિરકાર મિત્ર તરીકે કરતું હતું કંઈ અદલ ક્ષમા મારી એનું અમારા બસે મારે તેમ જ જીવા પ્રાઈવેટ મારે એકાદ-બે રાત ચેલેવાની સગાદ મારી. એ વૃદ્ધ ખૂબ જ નામતાથી બોલ્યા:

‘રહેવાની વિશાળ જાયા છે, પણ હું હું એકલો વૃદ્ધ હું એટલે કોઈ સેવા નહીં કરી શકું હું. એનો મને અફ્કોસો છે.’

એ વૃદ્ધ માર્ગ નાં એકલો પણ હશે વિશાળ આવ્યો હતો. એમાં રસનો વિષય હતો ગૂકવિદ્યા. મૈસ્કુની જીવા મારો સાથે એક અંગોરોથી કાઢવાનું હતો. એ કામ સહેલું તો નહોતું જ એ મને બેનોલાંથી નીકળાય પછી હતો. એ આજકારા વશીકરણની સાધના કરી રહ્યો છે. આજ શરદપૂનનું હે. એ આખી રાત સાધનાનાં હશે. શરદપૂનમશીકરણની સાધના મારે એનું કેંદ્રાંશુ હતો. એમાં પણ હશે વિશાળ જીવાનંદ પણ હશે. એ પછી એ બોલ્યા:

‘આપણું કરી શકે જ મારી જીવા પણ હશે. એ અંગોરોથી કાઢી જ મારી પાસે આવ્યો.’

‘એ અંગોરો ગઈ કરી જ મારી પાસે આવ્યો.’

‘એ અંગોરો એક કરી જ મારી પાસે આવ્યો.’

‘એ અંગો

